



જનસંપર્ક અધીકારી દ્વારા
પોલીસ કમિશનરશ્રીની કચેરી, અમદાવાદ શહેર
ટેલીફોન નંબર ૨૫૬૩૩૩૩૩



કંટ્રોલરૂમ ટેલી.નં. ૨૫૬૩૦૧૦૦,૨૫૬૩૦૨૦૦,૨૫૬૩૦૩૦૦,૨૫૬૩૦૪૦૦

ફેક્સ: ૨૫૬૩૦૬૦૦

તા.૦૧/૧૨/૨૦૧૪ સોમવાર

અમદાવાદ શહેર પોલીસ સમાચાર

શહેર પોલીસ ધ્વારા કરવામાં આવેલ પ્રશંસનીય/નોંધપાત્ર કામગીરી:-
વટવા પોલીસ સ્ટેશન

સમાચાર યાદી ૨૯૩૫/૧૪

વટવા પોલીસ સ્ટેશન સેકન્ડ .ગુ.ર.નં.૩૫૩૩/૨૦૧૪ ધી આર્મ એક્ટ કલમ ૨૫(૧) (બી) (એ) મુજબ કામના આરોપીઓ (૧) સોનુ સન/ઓફ ગોકુલસિંગ નારાયણસિંગ જાતે ભદોરીયા ઉવ ૨૯ રહે .ધનજીભાઈ સથવારાના મકાનમાં મેલડીમાતાના મંદીરપાસે હવાડા ચોક ધંધુકા જી અમદાવાદ મુ ગામ સિયાના ચોરાહા તાલુકો થાણુ મિયાણા જીલ્લો ગુના મધ્યપ્રદેશ નાની પાસેથી પેટની ફેટમાંથી એક દેશી હાથ બનાવટનો તમંચો અને તેના પેટના ખિસામાંથી ૦૭ જીવતા કારતુસ મળેલ જેના નીચેના ભાગે 8MM K F જેવુ લખેલ છે તેમજ રોકડ રૂપિયા ૨૦૦૦/ અને એક સેમસંગ મો.ફોન મળી આવેલ જેનો કનેકશન નંબર ૯૬૯૪૭૭૩૪૪૧નો હોવાનુ જણાવે છે જેની કિરુ ૫૦૦/૦૦ ગણાય (૨) પ્રભાતસિંગ સન/ઓફ જમનાદાસ ભમરસિંગ તોમર ઉવ ૩૨ રહે ગામ શિકરી કા પુરા તા.અંબા જીલ્લો મુરેના મધ્યપ્રદેશ નાની પાસેથી શર્ટ નીચે પેટની ફેટમાંથી એક દેશી હાથ બનાવટનો તમંચો અને તેના પેન્ટના ખિસામાં ૦૩ જીવતા કારતુસ મળી આવેલ જેના નીચેના ભાગે 8MM K F લખેલ છે તથા એક નોકીયા મો.ફોન કિરુ ૫૦૦/૦૦ તેમજ પર્સમાંથી ડ્રાયવીંગ લાસસંસ ,ઇલેકશનકાર્ડ,એટીએમ કાર્ડ નંગ -૨ તથા પાનકાર્ડ તથા ત્રિવેણી ઇન્ફાસ્ટ્રકચરનુ આઈ કાર્ડ મળી આવેલ (૩) અનિલ સન/ઓફ રામનિવાસ શ્રીચંદ જાતે ઓઝા ઉવ ૨૭ રહે. રહે ગામ શિકરી કાપુરા તા.અંબા જીલ્લો મુરેના મધ્યપ્રદેશ ના શર્ટના નીચેના ભાગે પેટની ફેટમાં છુપાવેલ એક દેશી હાથ બનાવટનો તમંચો મળી આવેલ અને તેના પેટના ખિસામાંથી ૦૪ જીવતા કારતુસ મળેલ જેના નીચેના ભાગે 8MM K F લખેલ છે તેમજ એક સેમસંગ મો ફોન મળેલ કિરુ ૫૦૦/૦૦ તેમજ તેની પાસેથી રોકડ રૂ ૧૮૦૦/૦૦ (૪) ભોલેસિંગ @ ભોલુ સન/ઓફ જડેલસિંગ પ્રકાશસિંગ જાતે ભદોરીયા ઉવ.૨૦ રહે. ગામ.ખંડેરીકા બડાપુરા થાના.અટેર જીલ્લો ભિન્ડ મધ્યપ્રદેશ નાની પાસેથી શર્ટની નીચે પેટની ફેટમાં પાછળના ભાગે છુપાવેલ એક દેશી હાથ બનાવટનો તમંચો મળી આવેલ અને તેના પેટના ખિસામાંથી ૦૬ જીવતા કારતુસ મળેલ જેના નીચેના ભાગે 8MM K F લખેલ છે તેમજ એક સેમસંગ મો ફોન કિરુ ૫૦૦/૦૦ જેથી તમામ ઇસમો પાસે વગર પરવાને દેશી તમંચાઓ નંગ ૪ કિરુ ૧૦,૦૦૦/૦૦ તથા કારતુસ નંગ ૨૦ કિરુ ૩૦૦૦/૦૦ ના તથા બોલેરો જીપ નંબર MH-34-AA-2410 નો ચેચીસ નંબર MA1PL2GHKBZE 79660 ENG NO GHB4E49197 નો છે તે બોલેરો જીપની કિરુ..આશરે ૪,૦૦,૦૦૦/૦૦ ગણી કુલ્લે રૂ ૪,૧૯,૮૦૦/૦૦ ના મુદ્દામાલ સાથે મળી આવતા ઉપરોક્ત તમામ આરોપીઓને સીની.પો.ઇન્સ.,શ્રી એચ.જે.ચૌધરી સાહેબ નાઓએ તા.૨૯/૧૧/૧૪ ના કલાક ૧૫/૩૦ વાગે પકડી અટક કરી કાયદેસરની કાર્યવાહી કરેલ છે.

અમદાવાદ શહેર તેમજ સિધ્ધપુર પાટણ ખાતે ઘરફોડ ચોરીઓને અંજામ આપતો વોન્ટેડ આરોપી ઈમરાન ફકીરને ઝડપી પાડતી ફાઈમ બ્રાન્ચ, અમદાવાદ શહેર

અમદાવાદ શહેરમાં વિસ્તારમાં બનતા મિલ્કત સબંધી ગુનાઓ શોધી કાઢવા તેમજ નાસતા ફરતા આરોપીઓ પકડવા સારુ પોલીસ કમિશ્નરશ્રી શિવાનંદ ઝા સાહેબના ઓએ આપેલ સુચના અનુસંધાને તેમજ ફાઈમ બ્રાન્ચના ઉચ્ચ અધિકારીઓના માગ્ડેશન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી આર.બી.રાણા તથા હેડ કોન્સ્ટેબલ હર્ષદકુમાર મનોહરભાઈ તથા સ્ટાફના માણસો સાથે પેટ્રોલીંગમાં હતા દરમ્યાંન સુભાષભ્રિજ સર્કલ આર.ટી.ઓ સર્કલ એસ.ટી.બસ સ્ટોપ ખાતે PC મહેતાબજી લક્ષમણજી નાઓની ભાતમી આધારે આરોપી ઈમરાનશા S/o અનવરશા દિવાન(ફકીર) ઉવ.૨૮ રહેવાસીઃ હાલઃ- છીપાવાડ, મુમતાઝબેન સરફરાજભાઈ ના મકાન માં, મામલતદાર કચેરીની પાછળ, કડી તાઃ- કડી જીલ્લોઃ ગાંધીનગર મુળ રહેઃ તાઢીરપુરા મોહલ્લા, પોલીસ લાઈનની બાજુમાં સિધ્ધપુર, તાલુકોઃ સિધ્ધપુર જીલ્લોઃ પાટણ નાને પકડી પાડવામાં આવેલ છે. જેની પુછપરછ દરમ્યાન તે સિધ્ધપુર સીટી પોલીસ સ્ટેશન ખાતે ઘરફોડ ચોરીના સાત ગુન્હાઓમાં સંડોવાયેલ છે અને અમદાવાદ શહેર ખાતે ચાંદખેડા વિસ્તારમાં ઘરફોડ ચોરીને અંજામ આપી આજ દિન સુધી નાસતો ફરતો રહેલ છે. જે અંગે વધુ પુછપરછ તપાસ ચાલુ છે.

નાયબ પોલીસ કમિશનર
કંટ્રોલરૂમ, અ'વાદ શહેર
પોલીસ કમિશનર વતી.